

તા.૧૮/૦૩/૨૦૨૦

પ્રતિ,  
તંત્રીશ્રી,  
દૈનિક.....

આજી-૧ ડેમમાં સૌની યોજના મારફત આજરોજ નર્મદાનું પાણી આવી પહોંચેલ  
હોય જેની સ્થળ મુલાકાત લેતા પદાધિકારીઓ....

આજી-૧ ડેમમાં ખૂટતો પાણીનો જથ્થો ઠાલવ્યા બાદ નારી-૧ ડેમમાં પણ નર્મદાનું  
પાણી ઠાલવવામાં આવશે.

નર્મદાનું પાણી આવતા શહેરમાં દૈનિક ૨૦ મિનીટ પાણી પુરવઠા વિતરણ માટે  
કોઈ મુશ્કેલી નહીં પડે.



રાજકોટ શહેરની વસ્તી તથા વિસ્તારમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. જેના કારણે સ્થાનિક જળાશયો મારફત દૈનિક ૨૦ મિનીટ પાણી પુરવઠો આખું વર્ષ પૂરું પાડવામાં મુશ્કેલ બને ત્યારે વિશેષમાં ભૂતકાળમાં રાજકોટના નગરજનોએ પીવાના પાણીની ખુબજ યાતના ભોગવી છે. અગાઉ પાણીકાપ એકત્રા તેમજ ૩ દિવસે ૧ વખત પાણી આપવાનો ઘટનાઓ બનેલ છે અને ઉદ્યોગોને પણ જોઈતું પાણી આપવામાં ખુબજ મુશ્કેલી પડતી આ બધી સમસ્યાઓને ભૂતકાળ બનાવવા રાજ્યના માન.મુખ્યમંત્રીશ્રીએ સૌની યોજના હેઠળ આજી, ન્યારી અને ભાદર જોડી દેવામાં આવેલ છે.

હાલમાં આજી-૧ ડેમમાં ૨૮૭ એમ.સી.એફ.ટી. પાણીનો જથ્થો છે. જે માર્ચ અંતમાં પુરો થનાર હતો ત્યારે આગામી ચોમાસા સુધી નિયમિત દૈનિક ૨૦ મિનીટ પાણી પુરવઠો આપી શકીએ તે માટે માન.મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા નર્મદાનું

પાણી આજી-૧ અને ન્યારી-૧માં પાણી આપવાનું મંજૂર કરેલ જેના અનુસંધાને આજરોજ આજી-૧ ડેમમાં કાળી પાટ પાસેનો ચેકડેમ તથા આવેલ ખાણો ભરાઈને નર્મદાનું પાણી આજીડેમમાં પહોંચી ગયેલ છે. જે અંતર્ગત મેયર બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈજાગાણી, વોટર વર્કસ કમિટીના ચેરમેન દેવરાજભાઈ મકવાણા (બાબુભાઈ આહીર) વિગેરેએ સ્થળ મુલાકાત લીધેલ. જે વખતે ડેપ્યુટી એન્જીનીયર ચેતન મોરી પણ હાજર રહેલ.

હાલમાં આજી-૧ ડેમમાં ૨૮૭ એમ.સી.એફ.ટી. એટલેકે ૧૬.૯૦ ફૂટ પાણીનો જથ્થો છે. સિંચાઈ વિભાગ દ્વારા હાલમાં એક પંપ ચાલુ કરેલ છે. જેના દ્વારા આજરોજ ૫ થી ૬ એમ.સી.એફ.ટી. પાણી ડેમમાં આવશે. એકાદ દિવસ બાદ વધુ પંપો ચાલુ કરી દરરોજનું ૩૫ થી ૪૦ એમ.સી.એફ.ટી. પાણી આવે તેવું આયોજન કરેલ છે અને ૧૫ થી ૧૬ દિવસ સુધીમાં આજી-૧ ડેમમાં ૬૦૦ એમ.સી.એફ.ટી. પાણી ઠાલવવામાં આવનાર છે. ત્યારબાદ ન્યારી-૧માં નર્મદાનું પાણી પુરવઠો ઠાલવવાનું શરૂ થશે. નર્મદાના પાણી આવતા આગામી ચોમાસા સુધી શહેરને દૈનિક ૨૦ મિનીટ સુધી પાણી આપવામાં કોઈ મુશ્કેલી સર્જાશે નહીં. આ તકે પદાધિકારીઓએ રાજ્યના માન.મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા સરકારશ્રીનો આભાર વ્યક્ત કરે છે.

(પી.એ.ટુ મેયર)